

## જ્ઞાન અને સ્વાનુભૂતિ—એક વિચારણા

લેખક : પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરીધરજીના શિષ્ય પૂ. પં. શ્રીલાનુવિજયજીજાણશિષ્ય  
પૂજ્ય સુનિ શ્રી અમરેન્દ્રવિજયજી

“ જ્ઞાની ક્ષાસોક્ષાસમાં કરે કર્મનો ઘેડ,  
પૂર્વોદ્દી વરસાં લગે અજ્ઞાની કરે તહે. ”

આમ જ્ઞાનનો ધોળું મહિમા શાસ્ત્રોમાં ગવાતો આપણે સાંભળીએ છીએ. પ્રશ્ન એ થાય છે કે જેનું આટલું બધું મહત્વ જ્ઞાનીએ આંકે છે એ જ્ઞાન શી વસ્તુ છે?

શું માત્ર પુસ્તકો વાંચી જવાં, ધણ્ણાં આગમો કંઠે હોવાં, કે એમાં ગણ્ણાવેલ પદ્ધતીઓના લાંગા અને લેદ-પ્રલેહો આંગળોના વેઢે ગણ્ણાવી શકાય એવી કુશળતા પ્રાપ્ત કરી લેવી, કે પછી પ્રતિલાસંપત્ત સાહિત્યનું નવનિર્માણ કરવું; એ જ્ઞાની થવા માટે જરૂરી છે? કે જ્ઞાની થવા માટે થીજુ પણ કોઈ શરતો છે?

એક રીતે જેઠીએ તો, જગતમાં આજે વિજ્ઞાન, વાણિજ્ય, કલા, તરત્વજ્ઞાન આદિ લિન્નલિન્ન દ્વારે ધારું જ્ઞાન લેશું કરતી અનેક વ્યક્તિએ આપણુને જોવા મળે છે.

અર્વાચીન વિજ્ઞાન માત્ર એક માખીના જ એટલા અધા પ્રકારો બતાવે છે, કે માણસ એ અધ્યાત્મનું—તેની દૈવો, સમૂહુદ્યવસ્થાદિતું—અધ્યયન કરે તે આખી જિંદગી પૂરી થઈ જાય. અરે! ઇક્તા કેાખીની એકસે જાતો ગણ્ણાવે છે વનસ્પતિશાસ્ત્ર. અને વિજ્ઞાનની આવી

૧. જ અન્નાણી કર્મં, ખવેદ બહુગાં વાસકોડિહિ ।

તં નાણી તિર્હિ ગુત્તો, ખવેદ ઉમાસમેત્તે ॥

—શ્રી ષૃંહતકદ્વાપલાભ્ય, ખંડ ૨. ઉદ્દેશી ૧, ગાથા ૧૧૭૦.

૨. કિયાશૂન્ય ચય જજ્ઞાન, જ્ઞાનરૂપ્યા ચ યા કિયા ।

અનયોરન્તરં હેયં, ભાનુખયોતયોરિવ ॥

—જ્ઞાનસાર, પ્રશ્નરિત, શ્લોક ૧૧.

તો કેટલીય શાખા-પ્રશાખાએ છે, તેમાંની કોઈ એકનું અધ્યયન કરવામાં જ આખી જિંદગી ખરચી નાંખનારા છે આ જગતમાં! ધારો કે કોઈ વ્યક્તિએ વિશ્વનાં મોટામાં મોટાં અથાલયોમાં ગણુના પામતી મોસ્કેની લાયઘેરીનાં ૪૦ લાખ પુસ્તકો વાંચીને ધારી લીધાં, એમાં લરેલું જાન મેળવી લીધું, તો આપણે એને જાની કહીશું? તમે કહેશો : “ના, એ તો ઇક્તા માહિતી કહેવાય.” તેમ કોઈ એ શાસ્વોનું અધ્યયન કર્યું, મોટામોટા જાનભંડારોમાં સંઅહીત સકળ શાસ્વોમાં પારંગતતા મેળવી, તો એણે જાન મેળ્યું એમ કહેશો કે માહિતી મેળવી એમ કહેશો ?

શાસ્વો તો લાં સુધી કહે છે કે સાડાનવ પૂર્વ ભણી જનાર પણ અજ્ઞાની હોઈ શકે.

જેમ પહેરવેશ ઉપરથી કોણ કેટલું ભણુંદો છે તે ન કહી શકાય—મેલાંધેલાં કપડાં વાળો વિદ્યાન હોઈ શકે એને મૂલ્યવાન કપડાં પહેરીને સુધડ હેખાતો માણુસ પણ અખૂજ હોઈ શકે—તેમ શાસ્વોના માત્ર ઓછા-વધતા જણુપણુથી જ જાની-અજ્ઞાનીનો વિલાગ ન કરી શકાય. ધણું ભણુંદો અજ્ઞાની હોઈ શકે; એને એક શાસ્વ ન ભણુંદો મહાજ્ઞાની હોઈ શકે.

તો પછી આરાધનાની કાયાપવટ-ધૂળનું સોનું-કરનાર “જાન” એ શી વસ્તુ છે ? જાનનું મહત્વ ખતાવનાર શાસ્વવચ્ચનોમાં “જાન” શરૂઆતી શુ અભિપ્રેત છે ? જાન શરૂઆતનો વાસ્તવિક અર્થ શો ?

કોઈ વ્યક્તિ ( હા. ત. નોષેલ પારિતોબિકના સ્થાપક આલફેડ નોષેલ )ના નામથી એને કામથી આપણે પરિચિત હોઈએ, પણ પ્રત્યક્ષ કે છથી દ્વારા એનું રૂપ જોયું ન હોય, તો એ વ્યક્તિનો આપણુંને અકસ્માતું લેટો થઈ જાય ત્યારે આપણે એને ઓળખી શકીએ ખરા ?

આપણે જાનને નામથી ઓળખીએ છીએ, એને કામથી—કિયા કરતાં અનેકગણી કર્મનિર્જરા કરાવનાર વળેરે તરીકે પણ ઓળખીએ છીએ; પણ એનું સ્વરૂપ શું?—એ વિચાર કરી કર્યો છે ? એને પિછાણી શકીએ એવી સિથિત છે આપણી ?

તો ચાલો, વિવિધ દિલ્હીકોણુથી જાનનું નિરીક્ષણ કરી આપણે એના સ્વરૂપનો અહીં વિશેષ પરિચય મેળવીએ.

### શુભુક્ષુની જાન-અવૃત્તિ

એ-ઝુનીયરીંગ લાઈનમાં દાક્તારીનું કે સર્જરીનું જાન એ કોઈ કવોલીક્રિકેશન-લાયકાત નથી; એ જાન ઈજનેરીના ક્ષેત્રમાં જાન ગણુંનું નથી; તેમ સફળ દાક્તાર થવા માટે કાયદાપોથીઓનું જાન ઉપયોગી નથી.

પ્રત્યેક ક્ષેત્રમાં ‘જાન’ એટલે તે તે ક્ષેત્રને સ્પર્શીતા વિષયનું જાન જ ગણુનાપાત્ર બને છે. દાક્તારને શરીરરચનાનું, રોગોનું, રોગનાં લક્ષણોનું એને દવાઓનું જાન જરૂરી; વકીલને કાયદાનું, સાક્ષીઓના માનસનું, સાક્ષીની ઊલટતપાસ ( Cross-examination ) ની આંટીધૂંટીનું; એને વેપારીને ધરાકનું, માલનું, બજારનું, બજારની રૂખનું જાન ઉપયોગી મનાય છે. વેપારી રાજકીય પ્રવાહો જણુવા ઈચ્છે તે પણ પોતાના વિષય સાથે એનો ને

સંખ્યાંધ છે, વેપાર પર એની જે અસર છે, તે જાણવા માટે. દાક્તાર કિરણોત્સર્ગ વિજે વાંચે તે શરીર ઉપર એની શી અસર છે એ વધુ સારી રીતે સમજવા અને એના પ્રતિકાર માટે શું થઈ શકે તેમ છે તે જાણવા.

એ જ રીતે, આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તે જ ગણ્યાય છે જે આત્મા સંખ્યાંધી હોય. મુસુક્ષુ બીજી વસ્તુઓનું—જગતનું જ્ઞાન મેળવે તે પણ આત્મા અને જગતનો સંખ્યાંધ સમજવા. જગતની માહિતી મેળવતાં પણ તેના કેન્દ્રમાં આત્મતત્ત્વ—ચૈતન્ય જ હોય. આત્મનિર્મણતાના પ્રકૃતીકરણમાં જે સહાયભૂત હોય તેવું જ્ઞાન જ અહીં ગણ્યનાપાત્ર અને છે. ચૈતન્યને બાળુએ રાણી એકલી જગતની માહિતી કોઈ ગમે તેટલી મેળવે, પણ આ ક્ષેત્રમાં એની ઉપયોગિતા ન ગણ્યાય. આત્મા, જગત અને એ એ વચ્ચેનો સંખ્યાંધ, એ મુસુક્ષુની જ્ઞાનપ્રવૃત્તિનો વિષય હોય.

પ્રથમ શુંત—શાસ્ત્રશ્રવણ કે અધ્યયન, પછી એના ઉપર ચિંતન, અને એમાંથી ભાવનાજ્ઞાન સુધી પહોંચે તેવો ક્ષયોપશમ જ બની જાય. આમ મુસુક્ષુનું જ્ઞાન આગળ વધતાં વધતાં સ્વાતુભવ સુધી પહોંચે.

શાસ્ત્ર ભાણીજવામાત્રથી આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. શુંતથી મેળવેલું જ્ઞાન પરોક્ષ છે, તેથી તે સ્પષ્ટ ન હોઈ શકે. “અસ્પષ્ટ પરોક્ષમ् ।”<sup>૩</sup> તેથી, આત્માનું અપરોક્ષ જ્ઞાન મેળવવું જોઈએ. “સ્પષ્ટ પ્રત્યક્ષમ् !”<sup>૪</sup>

આપણા રોજના વ્યવહારમાં પણ “દાક્તારે કે વક્તિલે કેટલાં પુસ્તકો વાંચ્યા છે ?”—એ નથી જોવાતું; પરન્તુ તે રોગનું નિદાન કરી શકે છે ? દ્વારાથી આપણને આરામ આપી શકે છે ?—એ જોવાય છે. એ કરી શકે તે દાક્તાર માન્ય બને છે; જે કેસ જીતી આપે તે વક્તિલ માન્ય બને છે; તેમ કર્મ સામે, ભવ સામે જીત આપાવે તે જ્ઞાન મુસુક્ષુ વાંચે છે. એ માટે શાસ્ત્રાધ્યયન સાથે સાધના જોઈએ.

લાખો શ્કોડપ્રમાણું સાહિત્યનું નવનિર્માણ કરનાર ઉપાધ્યાયજી શ્રીમહૂ યશોવિજયજી મહારાજને અનુભવજ્ઞાન લાધ્યું ત્યારે એમના મુખેથી સરી પડેલા આ ઉદ્ગાર છે :

“સંશ્ય નવિ લાંજે શુતજાને, અનુભવ નિશ્ચય જોડો;  
વાહવિવાહ અનિશ્ચિત કરતો, અનુભવ વિષુ જથ હોડો રે.”

અનુભવજ્ઞાનના નિર્મણ પ્રકાશ આગળ જીવનસરના અથાક પરિશ્રમથી મેળવેલું ખોલ્ણું શુંતજ્ઞાન એમને કિશ્કું લાગે છે, “બૂડું” લાગે છે.<sup>૫</sup>

આત્મસ્વરૂપનું અભાન એ જ અજ્ઞાન છે. એ અજ્ઞાન ધારી આપે તે જ્ઞાન. હેઠાં ધ્યાસ એણે—હેઠાં આત્મભૂદ્ધિ એણે કે “હું” એ ભૂદ્ધિ એણે, સ્વરૂપનું અનુસંધાન ચાલુ રહે-કર્મકૃત લાવોામાં “હું” ભૂદ્ધિ ન થાય, તેનું નામ જ્ઞાન.

૩. પ્રમાણનયતત્ત્વાલેખ, પરિચ્છેદ ૩, સૂત્ર ૧.

૪. એજન, પરિચ્છેદ ૨, સૂત્ર ૨.

૫. પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગૂઠો;

જ્ઞાનમાહિ અનુભવ તિમ જાણો, તે વિષુ જ્ઞાન તે જૂઠો રે.

—આપણાસ, ખંડ ૪, ધાર્ણ ૧૩.

આત્માનું એવું નિર્મણ, કર્ણોપકર્ણું પ્રામ થયેલું નહિ પણ પોતીકું જ (firsthand) સ્પષ્ટ જ્ઞાન મેળવવા એનું પ્રત્યક્ષ દર્શાન-સ્વાતુભૂતિ આવશ્યક છે. આત્માનું આવું અપરોક્ષ જ્ઞાન, જ્ઞાન તરીકે ગણુનાપાત્ર છે.

કેરી વિષે પુસ્તકોનાં પુસ્તકો વાંચીએ, પણ જ્યાં સુધી તેને ચાખીએ નહીં ત્યાં સુધી તેનો સ્વાદ નથી મળતો, એટલું જ નહિ, એ (સ્વાદ) ની યથાર્થ સમજણું પણ નથી મળતી. એવું જ આત્મા વિષે છે. શુતથી, તર્ક-યુક્તિ-આગમ વગેરેથી એની ઔદ્ઘ્રિક પ્રતીતિ મળે, પરંતુ ગમે તેટલું વાંચીએ, સાંખ્યણીએ કે વાતો કરીએ પણ જ્યાં સુધી આત્માને આત્મા પોતે-ઈન્ડ્રિયો કે મનની મહદ વિના-સાક્ષાત્ ન જુએ, એ આનંદસાગરનો અનુભવ ન મેળવે, ત્યાં સુધીની આત્મા વિષેની આપણી સમજ અધૂરી જ રહે છે. એક વાર પણ આત્માને નિબન્ધનો અનુભવ થઈ ચૂક્યો હોય ત્યારે જ આત્મતત્ત્વને તે યથાર્થપણે સમજી શકે છે.

### સાધના-પ્રક્રિયા

ગ્રન્થ એ થાય કે અનુભવજ્ઞાન સુધી પહોંચાય શી રીતે ?

અહીં સુખય વાત તો સ્વાતુભૂતિ માટેની તીવ્ય વ્યાકૃતિ અને ઉત્કટ અખના જગવી એ જ છે. આ માનવસવ એમ જ નથી ગુમાવવો એવી તીવ્ય ચટપટી લાગી જાય તો ઉપાય અવશ્ય હાથ લાગે. આવશ્યકતા એવી વસ્તુ છે કે તે આપમેળે જ બધું શોધી કાઢે છે.

આ વ્યાકૃતિ પ્રગટયા પછી સત્તા, પ્રતિષ્ઠા, નામના, કીર્તિ આહિની આકંશા નિવૃત્ત થાય છે; એમાં મેળવવા જેવું કંઈ લાગતું નથી. બાળક નાનું હોય છે ત્યાં સુધી એ ઢીંગલીએ સાથે રહે છે અને એ રમતમાં આનંદ મેળવે છે. મોટું થતાં એ રમત તે છોડતો જેય છે. તેવું જ જગતની વસ્તુઓનું છે. તેમાં જ્યાં સુધી આનંદ આવે, મેળવવા જેવું લાગે, ત્યાં સુધી સમજવું કે હજુ બાળકઅવસ્થા છે. શાસ્ત્રો એને ‘લવણાળકાળ’ ડાડે છે; ધર્મધ્યાવન આવતાં જ એ બધું શૂટી જાય છે અને તે આત્મા સલ માટે હોડે છે.

એટલે પ્રથમ તો જીવનના ધ્યેય વિષે નિશ્ચય થવો જોઈએ. ધ્યેય નક્કી થયા પછી એની સિદ્ધ અર્થે શું જરૂરી છે તે જાણી લઈ, સાધકે પોતાની સાધનાની યોજના (plan) ધરી કાઢી, એ પ્રમાણે જીવનનું ધરતર કરતાં, પ્રથમ નજીકનાં અને પછી ફૂરનાં લક્ષ્યો સિદ્ધ કરતાં, આગળ વધવું જોઈએ.

\*

### આપણી સાધના-પ્રક્રિયાનું ટૂંકમાં દર્શાનું

(૧) ધ્યેય : સુક્રિતા=સર્વકર્મ રહિત થઈ સ્વરૂપમાં સ્થિતિ.

(૨) સર્વ કર્મના ક્ષય માટે : આત્મજ્ઞાન (આત્મા સંબંધી માત્ર ઔદ્ઘ્રિક જાણપણું નહિ

ડ. “આત્મનિરીક્ષણ” (‘ધર્મચક્ર’ દેખુંથારી-એગ્રીલ, ૧૯૬૨) અને ‘આધ્યાત્મિક જીવિતાન’ (‘કલ્યાણ,’ મે-જૂન, ૧૯૬૩) એ રાખ્યા કા હેઠળ લેખક અહીં રજૂ કરવામાં આવેલા મુદ્રાઓમાંના કેટલાક મુદ્રાઓનું વિશેષ વિવેચન કરેલું છે.

મુ. શ્રી અમદેન્દ્રવિજયજી : જ્ઞાન અને સ્વાતુભૂતિ—એક વિચારણા।

૬૩

પરંતુ આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન ) પ્રાપ્ત કરવું રહ્યું.<sup>૭</sup>

(૩) આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે : આત્મા શરીરથી તદ્દન જુદો છે એનો સાક્ષાત્કાર કરવાના ઉદેશથી ધ્યાનની સાધના જરૂરી છે.<sup>૮</sup>

(૪) ધ્યાનના સિદ્ધિ ભાટે : પ્રથમ ચિત્તની એકાશતા પ્રાપ્ત કરવી રહી.

(૫) ચિત્તની સ્થિરતા ભાટે : ચિત્તની નિર્મણતા અને શરીરશુદ્ધિ આવશ્યક છે.

(૬) ચિત્તના નિર્મણતા સંપાદન કરવા : સ્વાધ્યાયમાં—શાસ્ત્રાભ્યાસ અને તત્ત્વચિંતનમાં—મન પરોવી હેઠું જોઈએ, જેથી બાધ્ય વિકલ્પો આપોઆપ ટળી જાય. સાથે સાથે મૈત્રી આદિ ચાર ભાવનાઓ અને અનિત્યત્વ આદિ ભાર ભાવનાઓથી ચિત્તને હુંમેશાં વાસિત કરતાં રહેવું જોઈએ.<sup>૯</sup>

(૭) મૈત્રી આદિ ભાવેની સિદ્ધિ ભાટે : એટલે કે એ ભાવેને જીવનમાં ઉતારવા અને સ્થિર કરવા ભાટે જીવનન્યવહાર ન્યાય-નીતિ, વ્રત-નિયમ, ત્યાગ-વૈરાગ્ય અને સંયમથી નિયંત્રિત હોવો જોઈએ.

(૮) શરીરના શુદ્ધિ આદિ ભાટે : તપની સાધના જોઈએ.

આ છે આત્મા અને કર્મને જુદાં પાડી આપનાર આધ્યાત્મિક સાધનાપ્રક્રિયા (process).

પાણીને તેનખાવાળું કરી તૈમાંથી વિદ્યુત પસાર કરીને, એકરૂપ (પાણીરૂપ) થઈ ગયેલ હાઈટોજન અને એકસીજન વાયુએને વૈજ્ઞાનિકો ધૂટા પાડી શકે છે, તેમ આત્મા અને કર્મને જુદાં પાડવામાં વ્રત, નિયમ, સંયમ, સ્વાધ્યાયરૂપ તેનખાન અને ધ્યાનરૂપ વિદ્યુત એ અને જરૂરી છે.<sup>૧૦</sup>

૭. (૧) આત્મજ્ઞાન ચ.....આત્મન : ચિત્રૂપસ્ય સ્વસંવેદનમેવ મૃગ્યતે ।

નાતો અન્યાત્મજ્ઞાન નામ ।

—યોગશાસ્ત્ર પ્રસ્તાવ ૪, શ્લોક ૩ની ટીકા

(૨) ભીરનીર પરે પુદ્ગલભિશ્રિત, પણ એહથી છે અગ્નો રે;

અનુભવ-હુંસચંચુ જો લાગે, તો નવિ દીસે વણગો રે.

—સમકિતન: સડકસઠ ઘોલની સજાય, ગાથા ૬૨.

૮. મોક્ષ: કર્મશાદેવ, સ ચાત્મજ્ઞાનતો ભવેત ।

ધ્યાનસાધ્ય મતં તત્ત્વ તદ્ધ્યાન હિતમાત્મન ॥

—યોગશાસ્ત્ર, પ્રસ્તાવ ૪, શ્લોક ૧૧૩.

૯. આભ્યંતર ( શૌચ ) મંત્રાદિભિશ્રીતમલપ્રકાલનમ્ ।

—દ્વારિંશદ્વારિંશિકા, ૨૨, શ્લોક ૨ ની ટીકા.

૧૦. (૧) પદમપોરિસિ સજ્જાયં, બોયં જ્ઞાં જ્ઞિયાયિ ।

તદ્દ્યાએ ભિક્ષાયારિય પુણો ચર્ચાએ સજ્જાયં ॥

—ઉત્તરાધ્યયનસ્તુત, અધ્યયન ૨૬, ગાથા ૧૨.

(૨) પૂર્વધરૂત શ્રી “ પંચસૂત ” મહાયનથમાં પણ સામાન્યથી મુનિનું વિશેપણું “ જ્ઞાન જ્જ્ઞાયણસંગાતો ” મૂકુધું છે, એકલું અધ્યયન નહિ.

(૩) સ્વાધ્યાયત્ત ધ્યાનમધ્યાસ્તાં, ધ્યાનાત્ત સ્વાધ્યાયમનેત્ત ।

ધ્યાનસ્વાધ્યાયસંપત્ત્યા, પરમાત્મા પ્રકાશતે ॥

—તત્ત્વાતુશાસન, અધ્યાય ૩, ૭, ( ૧૧ ).

આ રીતે આપણું ધ્યેય—આત્મજ્ઞાન—તું અંતિમ સાધન ધ્યાન છે; <sup>૧૧</sup> એ લક્ષમાં રાખી “એની પ્રાપ્તિ કરાવવા માટે મહાત્મતાદિ યમ, નિયમ, તપનું આસેવન છે.”—એ સમજપૂર્વક આરાધના થવી જોઈએ; <sup>૧૨</sup> એમ થાય તો, એ આરાધના ઉત્તરોત્તર વધુ આત્મ-વિકાસ કરાવનારી બને. યમ, નિયમ, તપ સીધાં જ મોક્ષપ્રાપ્ત નથી, પરંતુ તે ચિત્તની શુદ્ધિ અને સ્થિરતામાં સહાયક અની પરંપરાએ મોક્ષસાધક છે.

યમ, નિયમ, તપ વગેરે સીધાં જ મોક્ષપ્રાપ્ત છે, એવી માન્યતાને કારણે, યમ, નિયમ, તપ, સંયમમાહિની શુદ્ધિ અર્થે જરૂરી આત્મનિરીક્ષણ ન રહેતાં, એનાથી નીપ-જવું જોઈએ પરિણામ પ્રગટતું નથી. હા. ત. તપના યથાયોગ્ય આસેવનથી નાડીશુદ્ધિ થવી જોઈએ; એટલે કે નાડીઓમાં રહેલ ભોણો (Toxins) બળી જાય; પરિણામે, શરીર હુલકું કૂલ લાગે અને, ધ્યાન, સ્વાધ્યાય આહિની આરાધનામાં શરીર વિધનભૂત ન રહેતાં, ચિત્તની સ્થિરતા સુલભ બને.

**જ્ઞાનપ્રાપ્તિ:** માટે બુદ્ધિની કેળવણી—બુદ્ધિના વિકાસ—ઉપરાંત ઝુદ્ધયની વિશ્વાળતા-ના વિકાસ <sup>૧</sup>ઉપર, સંયમ <sup>૨</sup>ઉપર, સંકલ્પશક્તિને સુદૃઢ બનાવવા ઉપર તથા ચિત્તને શાંત, શુદ્ધ અને ઈચ્છાનુસાર એકાશ કરવાની શક્તિ સંપાદન કરવા ઉપર વધારે ધ્યાન અપાવું જોઈએ. અંતઃકરણુની આવી અવસ્થામાં જ વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. <sup>૩</sup> તત્ત્વદર્શન મનની પ્રશાંત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. માટે ચિત્ત ઉત્તરોત્તર વિકલ્પરહિત પ્રશાંત અનનું જાય, અને સમય સ્થિર થતું જાય, એ દિશામાં નિત્ય, અવિરત પ્રયાસ કરવો જોઈએ. સામાયિક ભાવની—સમલાવની—સ્થિરતાથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. <sup>૪</sup> સામાયિક ભાવ જેટલો ભાડો તેટલું જ્ઞાન ભાડું.

#### કુટજ્ઞાનપ્રાપ્તિમાં જરૂરી વિવેક

સ્વાનુભૂતિ સુધી પહોંચવા માટે જરૂરી સાધનાનું આપણે વિહુંગાવદોકન-જિડતું અવલોકન-કયું; પણ ત્યાં સુધી પહોંચીએ તે પહેલાં આપણે અનુભવીએના વચનથી—શુતથી નલાવવું રહ્યું. એ જ્ઞાનાર્જનના વિષયમાં પણ આપણું ચિત્તમાં સ્પષ્ટતા હોવી જોઈએ. ડોઈ એક વિષયનું જીવનકાર અધ્યયન કરતાં રહીએ તોય પાર ન આવે એટલાં શાસ્ત્રો છે. માટે આપણું ધ્યેય વિશે નિશ્ચિત દર્શિ ડેળવી, “શાસ્ત્ર ધણ્યાં ભતિ થોડલી” —એ વિચારનો જ્યાલ રાણી વિવેકપૂર્વક એમાંથી પસંગળી ન કરીએ તે નિંદગીભર શાસ્ત્રો લણું રહીએ—થતાં આત્મોન્નતિની દર્શાએ ખાસ લાલ ન થાય, એવું થ બને.

૧૧. આત્મજ્ઞાનફળ ધ્યાન—માત્મજ્ઞાન ચ સુક્ષિદમ્ ।

—અધ્યાત્મસાર, પ્રસ્તાવ ૬, શ્લોક ૧.

૧૨. મૂલોત્તરગુરુઃ સર્વે, સર્વ ચેયં બહુધિકા ।

મુનીનાં શ્રાવકાણાં ચ ધ્યાનયોગાર્થમીરિતાઃ ॥

—ઉપભિતિભવપ્રપંચા કથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૬.

૧૩. વિશ્વતિવિભિન્ના, ૧, ગાથ ૧૭-૨૦.

૧૪. યદિં તદિતિ ન વબતું સાક્ષાદ ગુરુણાડપિ હન્ત શક્યેત ।

ઔદાસીન્યપરસ્ય પ્રકાશતે તત્ તત્વં સ્વયં તત્વમ् ॥

—ધોગશાસ્ત્ર, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૨૧.

માટે, પ્રારંભમાં, વિશ્વમાં રહેલ ચૈતન અને જડ પદ્ધાર્થીના સ્વભાવનું શ્રુતથી લખ્ય દર્શાન પ્રાપ્ત કરવા તેમને અંગે આગમ દ્વારા—અનુભવીયાના વચ્ચેન દ્વારા—જાણુપણું મેળવવું રહ્યું, કે જે પોતાને સ્વભાવદશામાં, અથવા એની વધુમાં વધુ નાણક રહેવામાં સહાયભૂત થાય.<sup>૧૫</sup> જગતના ચૈતન-અચૈતન પદ્ધાર્થીનું જે જાણુપણું વિલાવદશામાં ઘસડી જાય તે જાણુપણું પણ અજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો લેદ “જાણુપણું—અજાણુપણું”નો નથી, પણ જે જાણુપણું આત્માને પોતાના સ્વભાવથી હુર લઈ જનાડું હોય —પછી લદે તે આગમ અન્ધોનું હોય—તે અજ્ઞાન<sup>૧૬</sup>; અને જે જાણુપણું સ્વભાવદશામાં સ્થાપિત થવામાં ઉપયોગી હોય કે સ્વભાવસન્મુખતા જગતનું હોય તે જ્ઞાન.<sup>૧૭</sup>

સાધકે પોતાની શ્રુતજ્ઞાનપ્રાપ્તિની પ્રવૃત્તિનું આ રીતે નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ.<sup>૧૮</sup>

૧૫. જગતશાયસભાવી સંવેગદૈરાગ્યાર્થમ् ।

—તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૧૮માં, અને

૧૬. અહુકારચુદ્ધ આહિ દ્વારા

સેકટે ગ્રીલ  
૧૭. સ્વભાવલાભસંસ્કાર—કારણ જ્ઞાનમિષ્યતે ।

૧૮. લ.

ધ્યાનધ્યમાત્રમતસ્વન્યત, તથા ચોક્ટ મહાત્મના ॥

—જ્ઞાનસાર, ૫ મું સાનાષ્ટક, શ્લોક ૩૧,

૧૯. આ દર્શિએ જેતાં જીવવિચાર, નવતત્ત્વ, કર્મઅંથ, સંગ્રહણી વગેરે અન્ધોભાંધી જ્ઞાન પ્રાપ્ત થસું કથારે કહેવાય ?—એનો વિચાર કંઈક આ રીતે કરી શકાય :—

દા. ત. જીવવિચારના અધ્યયનની—નાના, નાના, નગણ્ય દેખાતા જીવો પણ આપણું જ્ઞાતમાં સમાન જ છે; જેમ મોટો ઝોડા અને તેની એક દૂધિની ડાપી; એતું કદ નાનું થતો ડેટલીક જીણી જીણી વિગતો પ્રથમ દર્શાને જણ્યાતી નથી, પણ એને એન્નાજ્ઞ કરવાનાં આવે તો, પહેલાં ન દેખાતી અધી વિગતો સ્કૂર થાય છે, તેમ નાના જીવનુંઓં—એક કુંધુઆ સુધ્વામાં—અને પોતાનાં પણ ડાઈ લેછ નથી; જે લેદ ભાસે છે, તે કર્મકૃત છે.

લવભભણ્ય માટે ડેટલું વિશાળ ક્ષેત્ર છે ! ડેટલી યોનિએ ! એકનિયાદિમાં કાયસ્થિતિ ડેટલી દીવાં છે ! ડાઈ વખત આપણે પણ એ અધી અવરથામાં સમય પસાર કર્યો છે વગેરે વિચારણા જગે અને તેથી અવભીડતા—પાપભીડતા જન્મે અને નાના કીટ-પતંગ પ્રત્યે તેમ જ પાપી અધ્યમ જીવો પ્રત્યે પણ ધૂશાસાવ કે નિરસ્કારની લાગણી ન જન્મે; પરંતુ તેમાં પણ દેખવામાં આવતા ચૈતન્યના અંશ પ્રત્યે માન (Reverance for life) અગટે.

નવતત્ત્વનું અધ્યયન થતાં—જીવ-અજીવની રૂપી સમજણ આવે; સાથે પોતાના વર્તમાનમાં દેખાતા પણિએ કર્મને લીધે છે, અને પોતાનું ખરું સ્વહૃપ કર્મથી અવરાયેલું પણથું છે એતું ભાન વધુ રૂપી જને; સ્વહૃપ પ્રગટ કરવાના સાધન તરીકે સંવર અને નિર્જરાનાં અંગે પ્રત્યે અભિરૂચિ જગે અને સ્વહૃપપ્રાપ્તિ( મુક્તિ) અર્થે તાલાનેલી જગે.

ક્ષેત્રસમાસ, ઘૂહતસંગ્રહણી (તૈયોકથીપિકા) નું અધ્યયન ચિત્તમાં ડેવા લય ગ્રેરે !—એક તીવ્ચાં-લોકમાં જ અસંખ્ય દીપસમુદ્રો ! અને તે પણ ડેટલા વિરાટકાય ! અને કદપનાને પણ થકણી નાખે એટલા વિસ્તારમાં પથરાયેલો આ તીવ્ચાંલોક પણ જેણી ખાસે વાખણો લાગે એવા જીર્ધલોક અને અદ્યાલોક !

શ્રુતથી શુદ્ધિ-અંત:કરણુની નિર્મળતા-જન્મે તો એ ઉપયોગી ગણ્યાય. પ્રત્યેક હકીકિત તે કાચા અનાજના દાણા જેવી છે, તેને ડોડારમાં સંઅહી રાજ્યે ન ચાલે. અનાજના દાણા વડે રસોઈ તૈયાર કરી, દાંત વડે ચાવી, તેને વોહીના ટીપામાં પરિણુમા-વીએ તો એ દેહુધારણુમાં ઉપયોગી અને; તેમ શાસ્ત્રોની હકીકતો અને વિગતોના સંઅહુસ્થાન માત્ર અન્યે કામ ન સરે. એ વિગતોમાંથી એક જીવનદિપિ આપ્ત થવી જોઈએ, જીવન પ્રત્યે નવું વલણ ઘડાવું જોઈએ; માત્ર હકીકતો કે માહિતીઓને ગળી ગયે ન ચાલે.

એકલું શ્રુત એ ડોડારમાં પડેલ ખીજ તુલ્ય છે.<sup>૧૬</sup> શ્રવણુ-વાચન પણી એના ઉપર ચિંતન થવું જોઈએ. ચિંતનથી જ્ઞાન વધે છે,<sup>૨૦</sup> અને તેથી મધ્યસ્થભાવ જન્મે છે,<sup>૨૧</sup>

આધુનિક ખગોળવિજ્ઞાન (Astrology) પણ કેવું મોટું અદ્ભુત સ્વીકારે છે તેનો ખ્યાલ પણ નીચેના અવતરણથી આવી શકે :

“ થોડા સમય પહેલાં એક ખગોળશાસ્ત્રીએ ૨૦૦ ઇચ્છિના વ્યાસના ડેમેરા-દૂરભીન (Telescope-camera) દ્વારા એક તારાવિશ્વનો ફોટોઅસ્ટ લીધો હતો. આ તારાવિશ્વ એટલું બધું દૂર છે કે (એક સેકન્ડ માઝથી ૧,૮૬,૦૦૦ માઈલની ઊંડે અહીં આવતા) તેના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતાં છ અભજ શૂર્ય લાગે છે ! અત્યાર સુધી શીખાયેલા તારાવિશ્વમાં આ તારાવિશ્વ દૂરમાં દૂર છે

“ આપણું નવ અહું અને સૂર્ય મળાને સૂર્યમંડળ અને. અને આવાં અખાં સૂર્યમંડળાનું એક તારાવિશ્વ અને ! એવાં તો ધર્યાં તારાવિશ્વો આ અદ્ભુતમાં છે.”

આ વિરાટ વિશ્વમાં બ્યક્ટિતું સ્થાન દરિયાડહાની રેતીના એક કણ જોટલું પણ કંદી શકાય અરું ? આ બધું નજર સામે તરફરતું હેખાય તો બ્યક્ટિને પોતાનાં ક્ષણિક, અદ્ય સુખદુઃખ ઉન્માદ કે જ્વાનિ જન્માણી શકે અર્થાત് ?

પોતાની આકાંક્ષાઓ, પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ કે નિષ્ઠળતાઓનું મહત્વ શું ? તેદોકથીપિકાના અધ્યયનથી કાળ અને સ્થળની વિરાસ્તાનું ભાન જાગે, પોતાની અદ્યપતા-લધૃતા સમજાય, અને પરિણામે નભતા પ્રગતે, તો આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તરીકે એ ગણ્યાનપાત્ર અને.

નહિનર, આજની (સ્કૂલો અને ડાલેજેમાં) ભૂગોળ અણુનાર વિદ્યાર્થી આધુનિક વિજ્ઞાનમાન્ય, વર્તમાનમાં દૃષ્ટ, પૃથ્વીનાં શહેર, ગામડા, નદીઓ, પર્વતો વગેરે ગણ્યાની શકે છે; અને પેદો આજે માનવાને જે અદૃષ્ટ છે તે સુધીનાં નદી નાર્દી, દરવાજા, જગતિ, પર્વતો વગેરે ગણ્યાની જ્વાની આવડત મેળવે એ પૈમાં ફેર કર્યા ? એ માહિતીનો એજ તો વ્યર્થ ન ગણ્ય જે એ શુદ્ધિને માર્ગ લઈ જતો હોય. વૃત્તિમાં કુદ્દક પણ પરિવર્તન થતું હોય તો જણું કે એ અધ્યયનથી ચિત્તમાં કંઈક જ્ઞાનનાં કિરણો પ્રગટ્યાં છે.

૧૬. વાક્યાર્થમાત્રવિષય, કોષ્ઠકગતવીજસચિભ્રમ જ્ઞાનમ् ।

શ્રુતમયમિહ વિજ્ઞેય,

—પોડશક, ૧૧, શ્લોક ૭

૨૦. ઉદક હવ તૈલબિન્દુર્વિસર્પિ ચિન્તામય તત્ સ્વાત् ।

—પોડશક, ૧૧ શ્લોક ૮

૨૧. શ્રુતજ્ઞાનાદ વિવાદ: સ્યાન્મતાવેશશ્વ ચિન્તયા ।

માધ્યસ્થયં ભાવનજ્ઞાનાત् સર્વત્ર ચ હિતાર્થિતા ॥

—વૈરાગ્યકદ્બલતા, સ્તાણક ૬, શ્લોક ૧૦૫૬

ખીજના પોતાનાથી લિખ વિચારો—મતો પ્રત્યે સહિષ્ણુતા પ્રગટે છે, અને એમાંથી કે સારું હોય તે અહિંદું કરી લઈ ખીજ અંશોની ઉપેક્ષા કરવાની ક્ષમતા આવે છે. ૨૨ ચિંતન પછી શુતને ભાવનાજ્ઞાન સુધી પહેંચાડવું જોઈએ; ત્યારે જ એ જ્ઞાન તરીકે પ્રતિષ્ઠા પામે છે. ૨૩

### જ્ઞાનની કસોટી : મનોશુદ્ધિત

જેનાથી ચિત્તમાં કંઈક શુલ્પ પરિવર્તન આવે તે શુંત ઉપયોગી મનાય. મનોશુદ્ધિત એ જ્ઞાનની કસોટી છે. મનોશુદ્ધિતમાં આગળ વધાતું હોય તો સાધક માની શકે કે પોતે જ્ઞાનમાં ખરેખર પ્રગતિ કરી રહ્યો છે; નહિતર જ્ઞાનની બ્રાન્ટ સમજવી. શાસ્ત્રે મનોશુદ્ધિતની ત્રણ કલ્ખાએ બતાવી છે :

૧. આર્ત-રૌદ્ર ધ્યાનમાં ઘસડી જનાર સંકદ્ય-વિકદ્યપનો વિચોગ, એ પ્રથમ કક્ષા.
૨. ચિત્ત ભદ્યસ્થવૃત્તિવાળું અને કે જેથી ધર્મધ્યાન સાધી શકાય, એ ત્રીજી; અને
૩. કુશળ-અકુશળ સકલ મનોવૃત્તિઓનો નિરોધ થઈ સ્વરૂપમાં સ્થિતિ, એ ત્રીજી કક્ષા. ૨૪

આ રીતે મનોશુદ્ધિમાં પ્રગતિ થતાં ચિત્તની ઉત્તરોત્તર અધિક એકાશ્રતા નિષ્પન્ન થતી જય છે. જીંડાણુથી વિચારતાં સમજશે કે સુક્ષ્મિત પર્યાતની સમજ સાધનાને મનોશુદ્ધિમાં અહીં આવરી લીધી છે. દૂંકમાં, સાધનામાં પ્રગતિ એટલે મનોશુદ્ધિમાં આગળ વધવું તે, એમ કહી શકાય.

જ્ઞાન કેમ કેમ પરિણામે તેમ તેમ કેમશા: મનમાંની ધર્યા-માત્સર્ય-દ્રેષ્ણની વૃત્તિએ વિહાય કે; તિરસ્કાર, ધૂણા આદિનું સ્થાન સહાતુભૂતિ, સમજ, ઔદ્યાર્ય અને વાતસદ્ય કે; જય, ચિંતા, સંક્લેશ એણી જય; તેમ જ તત્ત્વચિંતનમાં અને સ્વગુણુની વૃદ્ધિ અર્થે આત્મનિરીક્ષણ આદિમાં એાતપ્રોત રહેવાથી અન્યની નરસી પ્રવૃત્તિ પ્રત્યે સહજપણે ઉદ્ઘાસીનતા.

૨૨. “ ગુણપ્રદરસિકાનાં પરવચનાતુપત્તિપરિદ્ધાપ્રવ્યાસ્વમાવત્વાત.... તથા ચ તસ્ય મૂળગનૈમેકવાક્યતા-માપાશ્યોપત્તિરેવ કર્તવ્યા, ઇથમેવ સમ્યગ્દૃષ્ટપરિગૃહીતસ્ય મિથ્યાશ્રુતસ્યાપિ સમ્યક્શુતસ્વસિદ્ધે: । ”

—ધોડશક ૧૬, શ્લોક ૧૩, ટીકા.

૨૩. (૧) અનેન હિ જ્ઞાતે જ્ઞાન નામ, કિયાડયેતું પૂર્વિકૈવ મોક્ષાયાડશૈપેણ સમ્પદ્યતે ।  
—ધોડશક, ૧૧, શ્લોક ૮૮ની ટીકા.

(૨) સમ્યગ્ભાવનાજ્ઞાનાધિગતાનાં ભાવતોડધિગતત્વસમ્ભવાત् ।  
—ઉપદેશ્ય ૫૬, ટીકા, ગાયા ૧૬૫.

૨૪. વિમુક્તકલ્પનાજાલં, સમર્પે સુપ્રતિષ્ઠિતમ् । આત્મરામં મનસ્તજ્ઞૈર્મનોગુપ્તિરૂઢાહૃત ॥  
ટીકા—આર્તરૌદ્રધ્યાનાનુબંધિકલ્પનાજાલવિયોગ: પ્રથમા ।

...ધર્મધ્યાનાનુબન્ધિની માધ્યસ્થપરિણિતિદ્વિતીયા ।

કુશલાકુશલમનોવૃત્તિનિરોધેન યોગનિરોધાવસ્થાભાવિન્યાત્મારામતા તૃતીયા ।

—ધોગશાખ, પ્રસ્તાવ ૧, શ્લોક ૪૧.

આવતી જ્યારે, એટલું જ નહિ, પણ પોતાના ભત્થી તદ્દન વિરોધી જણીતી વિચારધારાને પણ તે સહી શકે એવી ક્ષમતા-પરમતસહિષ્ણુતા( tolerance )નો ગુણ તેનામાં વિકસતો જ્ય છે. ૨૬ કમશા: જીવનનાં અન્ય દ્રન્દોમાં પણ એ ઉત્તરોત્તર અધિક સમત્વ કેળવતો આગળ વધે છે. પરિણામો, એના ચિત્તમાં પ્રસન્નતા, શાન્તિ, સ્વસ્થતા સહજપણે રેખાતાં રહે છે. મનોશુભ્રિની થીજી કક્ષા વટાવી ગયા પછી નિશ્ચય-રત્નત્રયમાં પ્રવેશ મળે.

### વ્યવહાર અને નિશ્ચય રત્નત્રયી

નવ તત્ત્વ, પડ્ દ્રોય આદિ શ્રી જિનેશ્વરહેવ(અર્થાત્ પૂર્ણજીવાની)કથિત લાવોને સારી રીતે જાણીને તેનું શ્રદ્ધાન અને તે મુજબ યથાશક્તિ સંયમ, વ્રત આદિનું આગ્રહણ એ છે વ્યવહાર-રત્નત્રયી અથવા લેદરત્નત્રયી. પરપરાર્થોણી ચિત્તને છોડીને પોતાના આત્માનું જ શ્રદ્ધાન, તેના સ્વરૂપનું જીવન અને ચિત્તને અન્ય વિકલ્પોથી રહિત કરી સ્વરૂપમાં જોડી, ત્યાં લીન કરવું તે છે નિશ્ચય-રત્નત્રયી<sup>૨૭</sup> અર્થાત્ અભેદરત્નત્રયી.

ચિત્ત છન્દ્રિયો, વિષયો અને ખાદ્ય પદ્ધાર્થો સાથે લેડવેલું રહે છે. તેમાંથી એંચીને તેને આત્મા સાથે લેડવાનો અલ્યાસ એ જ પારમાર્થિક થોગ છે. વ્યવહાર નિશ્ચય સુધી લઈ જવા માટે છે. ૨૮ વ્યવહાર-રત્નત્રય કારણ છે, નિશ્ચય-રત્નત્રય કાર્ય છે. જેનાથી કાર્ય ન થાય તે કારણ તરીકે ગણુના પામે નહિ.

શુત કેટલું મેળવવું આવશ્યક છે ?—એ ડોયડાનો ઉકેલ આમાંથી મળી રહે છે. આર્ત-રૌદ્ર ધ્યાન ટાળી શકાય અને ધર્મ-શુક્લ ધ્યાનમાં પ્રવૃત્તિ કરી શકાય એટલું શુત સાધકની પ્રાથમિક જરૂરિયાત મનાઈ છે. ૨૯

મુનિનો એક મનોરથ એ હોય કે “ કયારે હું શુતસાગરનો પાર પામું.” પણ સમગ્ર શુતસાગરનો પાર પામવો કેટલાને શક્ય હોય ? સમગ્ર, શક્તિ અને સંચોગાની મર્યાદા એ મનોરથની સિદ્ધિની આડે નડતી હોય છે. તેથી સાધકને માટે ડોયડા એ રહે છે કે કેટલું અને શું ભણું ? આ મૂંઝવણુના ઉકેલ માટે શાસ્ત્રે સાધકને શું અને કેટલું ભણું ? —એ ન કહેતાં આર્ત-રૌદ્ર ધ્યાન નિવારી ધર્મ-શુક્લ ધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકાય એટલું

૨૫. જીનગર્ભિત વૈરાગ્યનાં લક્ષ્ણોમાંતું એક આ છે :

“ ચેષ્ટાપરસ્ય વૃત્તાન્તે, મૂકાન્ધબધિરોપમા । ઉત્સાહ: સ્વગુણભ્યાસે, દુસ્થસ્યેવ ધનાર્જને ॥ ”

—અભાત્મસાર, અધિકાર ૬, શ્લોક ૪૧

૨૬. (૧) માધ્યસ્થય યાદે નાયાત, ન તદ્દન જ્ઞાનગમ્ભીતા । —એજન, અધિકાર ૬, શ્લોક ૩૭.

(૨) જીવો ઉપાધ્યાય શ્રી ધર્માવિજ્યળ મહારાજકૃત અધ્યાત્મોપનિપદ, શાસ્ત્રયોગ શુદ્ધિ, શ્લોક ૭૦-૭૧.

૨૭. આત્માઽત્મસ્યેવ યચ્છુદ્ર, જાનાત્યાત્માનમાત્મના । સેવને રત્નત્રયે જ્ઞાપિ-સ્વચ્છાચારૈકતા સુને: ॥

—જીનસાર, ૧૩ મું મૌનાષ્ટક, શ્લોક ૨.

૨૮. વ્યવહારોડપિ ગુણકૃદુ, ભાવોપદંભતો ભવેત । સર્વથા ભાવહીનર્સુ, સ જેણો ભવવૃદ્ધિકૃત ॥

—વૈરાગ્યકલ્પલતા, સ્તખ ૬, શ્લોક ૧૦૧૮.

૨૯. ઉપદેશપદ, દીક્ષા, ગાથા ૮૬૭.

શ્રુત મેળવવાનું ખાડુમૂલું સૂચન કર્યું છે. પછી એ પાંચ થન્યો હો કે પિસ્તાલીસે આગમો હો કે માત્ર અષ્ટપ્રવયનમાતાનું જ જ્ઞાન હો. જે આ કાર્ય ન થતું હોય તો બહેળું શ્રુત પણ લારડ્યું સમજાલું.<sup>૩૦</sup>

સમિતિ-ગુસ્તિનું જ્ઞાન એટલે શું ?

જે હ્યાવાન છે, કરુણાર્દ્ર છે, નિર્દ્દાલ છે, ગુણુંથાહી છે, તે જ્ઞાન એક પદ જ જાણુંશે હોય તોચે જ્ઞાની છે.<sup>૩૧</sup>

સમિતિનું જ્ઞાન એટલે ઈર્યા વગેરે સમિતિ કેમ જોવી, નજર નીચી જ ઢાળેલી રાખવી, બોલતાં મુહુપત્તિ મુજે રાખવી, કે પૂંજવું-પ્રમાર્જવું એટલું જ માત્ર નહિ પણ એની પાછળ આણીમાત્ર પ્રત્યેના વાતસદ્વયથી ધખડતું હૈયું જરૂરી છે. સમિતિ અને ગુસ્તિને પ્રવયનમાતા કહી. શાથી ? ભીજના સુખમાં પોતાના હાથે કંઈ ભાધા ન આવે, કાઈને પીડા ન થઈ જય, એવી કાળજીપૂર્વક જીવનું એ છે સમિતિનો પ્રાણ; પ્રવયન (જિનશાસન) જીવો પરના વાતસદ્વયથી લરપૂર છે, જીવો પ્રત્યેના વાતસદ્વયમાંથી જન્મેલું છે, અને જીવો પ્રત્યેના વાતસદ્વયથી લરપૂર હૈયામાંથી એ ઉદ્ભાવનું છે, માટે સર્વના સુખની-હિતની ચિંતાને પ્રવયનની માતા કહી.<sup>૩૨</sup>

સમિતિપૂર્વકનું જીવન એટલે જગત સાથે પ્રેમ, સહાતુભૂતિ, સહકાર, સહિષ્ણુતા-પૂર્વકનો જીવનવ્યવહાર.

ગુસ્તિ શું માગે છે ? પરમાં પ્રવૃત્ત થતાં મન, વાણી, હેઠને લ્યાંથી પાછાં વાળી એકાંત અને મૌન દ્વારા નિજમાં ઉતારવાની પ્રક્રિયાનો અભ્યાસ.

આ છે સમિતિ-ગુસ્તિપૂર્વકનું જીવન.

અધ્યયન વિના પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે ?

આવું વિશુદ્ધ જીવન હોય અને એની સાથે તત્ત્વદર્શનની તીવ્ર જિજાસા હોય તો જ્ઞાન આપોઆપ પ્રગટે છે. જેનું અંતઃકરણ નિર્મળ હોય તે અદ્વિત્ય શ્રુતમાંથી પણ તત્ત્વ-ભૂત વાત અહુણું કરી લે છે.<sup>૩૩</sup> સચોગવશાતું શ્રવણું કે વાચનની તક ન મળે, પરંતુ તત્ત્વ પામવાની તીવ્ર જિજાસા હોય તો એવી વ્યક્તિને શ્રુત વિના પણ જ્ઞાન પ્રાપ્ત થઈ

૩૦. “ સાર લલા વિષુ ભાર કલ્યો શ્રુત, ખર દ્વારાંત્રં પ્રમાણ; ”

— ચિહ્નાંદ્લુ મહારાજ.

૩૧. નિર્વણપદમાયેકં, ભાવ્યતે યન્મુહુર્મુહુઃ । તદેવ જ્ઞાનમુકૃષ્ટં, નિર્વચ્યો નાસ્તિ ભૂયસા ॥

— શાનકાર, ૫ મું જ્ઞાનાષ્ટક, મ્લોક ૨.

૩૨. પ્રવચનસ્ય પ્રસૂતિહેતુચ્ચેન હિતકારિચ્ચેન ચ માતૃત્વમબસેયમ् ।

— ષોઃક, ૨, મ્લોક ૮, ટીકા.

૩૩. “ ...તે હિ બહિર્બુધુતમપઠનોડપિ અતિતીર્ણદ્યુક્ષમપ્રજ્ઞતયા બહુપાઠકસ્થૂલપ્રજ્ઞાનુપલબ્ધં તત્ત્વ-મવબુદ્ધન્ત ઇતિ । તડુકં—

સ્પૃશન્તિ શરવતીક્ષણઃ સ્વલ્પમન્તરવિશન્તિ ચ ।

બહુસ્પૃશાપિ સ્થ્રોણ સ્થીર્યતે બહિરસમવત् ॥ ”

— ઉપદેશપદ, ગાથા ૧૬૩, ટીકા.

ભાગ.૩૪ વિશુદ્ધ અંત:કરણુમાં જ્ઞાનનો પ્રકાશ આપોઆપ થાય છે. ૩૫

જ્ઞાન બહારથી જ મળે, એવું આપણા ચિત્તમાં વસી ગયું હોવાથી, કોઈ મળે લારે, એની જ્ઞાનમાં થયેલ પ્રગતિ જાણવા, આપણે પૂછીએ છીએ કે ન્યાય લણ્યા? વ્યાકરણ કથું? આગમો કેટલા વાંચ્યા? પણ એ તો જ્ઞાનપ્રાપ્તિનાં અહિરંગ સાધન છે. માત્ર શરૂદો, સૂત્રો કે સિદ્ધાંતોનો સંશુદ્ધ એ એક વસ્તુ છે અને ચેતનામાં તે અંકુરિત થધી પાંગરે તથા તેના ઇણ સ્વરૂપ શીલપર્યવસાયી પ્રજ્ઞા જન્મે તે જુદી જ વસ્તુ છે. ચોગનું રહુસ્ય સાધનાથી ખૂલે છે; કેવળ અન્યાના અધ્યયનથી જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. ધારો કે જાણી શકાય તે બધું તમે જાણી લીધું. પછી પણ તમને જણુણો કે એથીય વધુ મહત્વનું કાંઈક તો જાણવાનું હજુ બાકી જ છે. વધુ જાણવાની જરૂરિયાત તમને જણ્યાયા જ કરશે; તમે કદીય એનો છોડો નહિ મેળવી શકો.

શાસ્ત્રવચનોનો અર્થું કાઢવાની શક્તિ પણ કેવળ ન્યાય-વ્યાકરણના નૈપુણ્યથી નથી પ્રાપ્ત થતી. ૩૬ શાસ્ત્રનો મર્મ સાધનાથી મળે છે—લાઘાજાન અદ્ય હોય તોપણ. “ચિંતનીય વિષયમાં હત્તચિત્ત હોય તેને તેવા એક જ પ્રકારના ઉપયોગને લીધે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ લાસે છે. એ જ જ્ઞાન આ ચોગમાર્ગમાં ધૃષ્ટસિદ્ધિનું સુખ્ય અંગ છે. એ જ તત્ત્વજ્ઞાન છે અને તે અસ્તુપ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવનારું જને છે.”<sup>૩૭</sup>

જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમને અધીન છે; એનું નિમિત્ત મળતાં, શ્રુત વિના પણ, જ્ઞાન પ્રગટી નીકળે છે. તત્ત્વજ્ઞિશાસનાની જેમ, સાચા જ્ઞાનીની લક્ષ્ણિ-અહુમાનાદિથી<sup>૩૮</sup> તેમ જ સુયોગ્ય શુરૂણી સમર્પિત ભાવે ઉપાસના

૩૪. શ્રુતાભાવેઽપિ ભાવે�સ્યા: ( શુશ્રૂષાયા: ) શુભભાવપ્રવૃત્તિતઃ ।  
ફરં કર્મક્ષયાખયं સ્યાત્પરબોધનિબન્ધનમ् ॥

—ચોગદિષ્ટસમુચ્ચય, શ્લોક ૫૪.

૩૫. સમલો ન વિજાનીતે, મોક્ષમાર્ગ યથાસ્થિતમ् । મલક્ષયે પુનસ્તસ્ય મોક્ષમાર્ગો યથાસ્થિતઃ ॥  
યત્ર તત્ત્વ સ્થિતસ્યાપિ, હઠાદેષ પ્રકાશતે । —ઉપભિતિભવપ્રપંચા કથા, પ્ર. ૮, શ્લો. ૬૦૩-૪.
૩૬. આ( ન્યાય-વ્યાકરણ )ના અધ્યયન પાછળ મુખુદ્ધારે સમય અને શક્તિ કેટલી ભરયવાં આપશ્યક ગયું? ભૂળ ધ્યેયની અપેક્ષાએ શાસ્ત્ર એ પણ સાધન છે. ભાષા-ન્યાય-વ્યાકરણનું અધ્યયન તો એ સાધનનું પણ સાધન માત્ર છે; શાસ્ત્રવચનોને સમજવા માટે તેનો ઉપયોગ છે. જીંદગીના અમૃત્ય વર્ષો કેવળ આ અધ્યયનમાં ખર્ચાઈ જાય અને સાધકણવનમાં ઉપયોગી આખતોનું-સાધનાં અંગેનું-જ્ઞાન મેળવવા માટે પણ અપકાશ ન રહે તો, એ સાધકણવનની ડેવી કરુણતા ગણ્યા!
૩૭. “તત્ત્વચિત્તસ્વ તહોવઓગો તત્ત્વમાસણ હોઇ । એવે એસ્થ પછાણ અંગ ખલુ ઇદૃસિદ્ધીએ ॥  
એં ખુ તત્ત્વાનાં અસપ્તવિચ્છિન્નિવિચ્છિન્નિસંજનગમ્ ।” —ચોગશતક, ગાથા ૬૫, ૬૬૩.
૩૮. “પ્રસ્તુતબુદ્ધિવનાનાં ઉચ્ચિતાચ્ચપાનાદિસમ્પાદનપાદધાવનગલાનાવસ્થપ્રતિજાગરણદિરૂપયા ભક્ત્યા,  
ચિન્તારલનકામદુધાદિવસ્તુભ્યોડપિ સર્માધકાદુપાદેયપરિણમાત્ર ( બહુમાનતઃ ), એતેષામેવ બુદ્ધિમતાં  
અપ્રદેષાદ ( અમસરાદ ઈર્ષાર્પિરિહારલક્ષણાત ), પ્રશાંસાતથ બુદ્ધિર્જયતે ।”  
—ઉપદેશ ૫૬, દીક્ષા, ગાથા ૧૧૨.

કરવાથી પણ જ્ઞાનપ્રાપ્તિ થાય છે.

આંતરિક નિર્મણતામાંથી જન્મતી આંતર સૂક્ષ્મ વડે સાધક યોગ્ય ગુરુને પારખી શકે છે. જે ગુરુએ પોતે શાસ્ત્રનું રહુસ્ય મેળોયું હોય અને મનઃશુદ્ધિ તથા ચિત્તસ્થૈર્ય માટેની સાધનામાંથી પસાર થઈને અનુભવ પ્રાપ્ત કર્યો હોય, તે પોતાના અનુયાયીવર્ગને સ્વાતુભૂતિજ્ઞન્ય યથાયોગ્ય માર્ગદર્શન આપી શકે છે. એવા સમર્થ ગુરુનાંથી ચરણું પહેઢનાર શિષ્ય, પોતાને વિશેષ જ્ઞાન ન હોવા છતાં, સરળતાથી આત્મવિકાસ સાધી શકે છે.

આ બધું સમૃતિમાં રાખી સાધક શુદ્ધતાનાર્જનની પ્રવૃત્તિ કરે. દૂર્કમાં, શુદ્ધતાનો મુખ્ય હેતુ ચિત્તવૃત્તિઓમાં પરિવર્તન લાવવાનો છે, એ મૂળભૂત વાત એ ન વીસરે.

### શુદ્ધતાની મર્યાદા

શુદ્ધતા—વાચન, શ્રદ્ધાયુ કે શાસ્ત્રાધ્યયનથી—આત્માનું પરોક્ષ જ્ઞાન મેળવી લઈ, એ જ પ્રાપ્તય છે અને તે (આત્મા) જિવાયનું બીજું બધું—રિદ્ધિઓ સિદ્ધિઓ કે શક્તિઓ એ બધું—માથા ઉપરથી ઉતારેલ વાળ કે આંગળીથી જુદા કરેલા નખ તુલ્ય અસ્સાર છે, એ વિચાર સ્થિર કરવો એ અધ્યયનનું પ્રથમ કાર્ય છે.

એ પછીની જ્ઞાનની બીજી ભૂમિકા છે સુક્રિતમાર્ગની સ્પષ્ટ સમજણ. જ્ઞાનયોગ, કર્મ-યોગ, લક્ષ્મિયોગ, રાજ્યોગ, લય્યોગ આહિ વિવિધ સાધના-પદ્ધતિઓ. અને તે સાથે ચિત્તની એકાશ્રતાની કેળવણી અર્થે ઉપયોગમાં લેવાતી અન્ય પ્રવૃત્તિઓનું—જેવી કે જ્ય, નાદાનુસંધાન, શાસોશ્વાસનું નિરીક્ષણ, ચિત્તમાં જિઠતા વિચારપ્રવાહનું તટસ્થ અવ-ક્ષેત્રન વગેરેનું—જ્ઞાન સંપાદન કરી, પોતાની પ્રકૃતિ, સંયોગો અને સામર્થ્યને અનુદ્દ્ય પ્રક્રિયા શોધી કાઢવી એ આ ભૂમિકાનાં શ્રવણ-વાચન-શાસ્ત્રાભ્યાસનું લક્ષ્ય હોય. શ્રવણ, ચિંતન અને વિર્મર્શ દ્વારા સુસુક્ષ્મ જ્ઞાન અને ડિયાના હાર્દ સુધી પહોંચે છે. અંતિમ ધોયે સુધી પહોંચાડનાર સાધનામાર્ગોમાંથી છેવટ કોઈ એકનું પણ અભ્રાંત દર્શન સાધકે મેળવી લેવું જોઈએ.

આ થઈ બૌદ્ધિક સમજની વાત. અહીં શાસ્ત્ર અટકી જાય છે. આત્મતત્ત્વનું પરોક્ષ જ્ઞાન અને રેણી (આત્મતત્ત્વની) પ્રાપ્તિનાં સાધનો તે બતાવી હે છે; શ્રવણ-વાચન અહીં સુધી પહોંચાડે છે; આંગળી ચીંધી માર્ગ બતાવી હે છે; પછીનો પંથ આપણે પોતે કાપ-વાનો હે.૪૦ પછી ચાલવું આપણે રહ્યું; જે સાંલજ્યું, વાંચ્યું તે જીવનમાં અનુભવવું રહ્યું.

આ બંને કાર્ય એકસાથે થતાં રહે છે; જેમ માર્ગ ઉપર થોડું ચાલીએ કે આગળ એક-એ ફર્લાંગ સુધીનો રસ્તો હેખાતો જાય છે, એટલું આગળ ન વધીએ ત્યાં સુધી એની આગળનો માર્ગ હેખાતો નથી.

૩૬. સ્વસંવિદિતામનસ્કોપદેશદાયિનો ગુરુન्.....સ્તૌતિ ।

—યોગશાસ્ત્ર, ટીકા, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૫૩ની અવતરણિકા.

૪૦. ધ્યાપાર: સર્વશાસ્ત્રાણાં, દિક્ષપ્રદર્શનમેવ હિ । પારં તુ પ્રાપ્તયેકોઽનુમતો ભવતારિષે: ॥

અતીન્દ્રિય પરં બ્રહ્મ, વિશુદ્ધાનુમત વિના । શાસ્ત્રયુક્તિશતેનાડપિ, ન ગાઢ્ય યદૂ બુધા જગુઃ ॥

—જ્ઞાનસાર, અતુભવાઽષ્ટક, શ્લોક ૨-૩.

આગમ, અનુમાન અને ચોગાલ્યાસ એ પણ વડે પોતાની બુર્જને કેળવતો સાધક ઉત્તમ તત્ત્વ પાંચી શકે.<sup>૪૧</sup> આગમથી અર્થાતું અનુભવીઓનાં વચ્ચનથી જે જાણ્યું તેને તર્ક દ્વારા વિશાળતાથી સમજવા પ્રયત્ન કરવો રહ્યો. સાથે ચોગાલ્યાસથી-પોતાના જાત-અનુભવથી-એની પ્રતીતિ મેળવતા જવાય તો અતીનિદ્રય વસ્તુના નિશ્ચિત જ્ઞાન સુધી ખેણ્યાય. સિદ્ધાંત (theory)માં જે સાચું સમજાયું તેને પ્રયોગાત્મક રીતે ચકાસીને વ્યવહાર (Practice) માં પણ તે સાચું છે એવી પ્રતીતિ મેળવતાં આગળ વધવું જેઈએ.

આગમ અને તર્કથી જ્ઞાન મળો, પણ તે અધૂરો; એનાથી શાંકાએ અને સંશાયો ન ટળો; એ ટળે ધ્યાનજન્ય જાતઅનુભવથી.<sup>૪૨</sup>

જ્ઞાનાર્થિની ભૂમિકાએ।

જ્ઞાનની પ્રથમ ભૂમિકામાં સંસારની નિઃસારતા એધથી સમજાય છે અને તેના નાશના ઉપાયની જાણુકારી માટે મુસુકુ શાસ્ત્ર અને ગુરુ અર્થાતું એ માર્ગે જે પોતાનાથી આગળ ગયેલા છે તેમના તરફ વળે છે. અર્થાતું આ ભૂમિકા આગમપ્રધાન છે.

બીજી ભૂમિકામાં શ્રવણ-વાયન સાથે વિચારણા-ચિંતન-મનન છે. આ ભૂમિકામાં તર્કની સુખ્યતા કહી શકાય. એથી અહીં, મુક્તિના ઉપાયોત્તું-જ્ઞાન અને કર્મનું-એટલે કે અનુષ્ઠાનતું નિર્મણ, અભાંત જ્ઞાન લાધે છે.

જ્ઞાનની ત્રીજી અવસ્થાથી શ્રવણ-મનન સાથે ચોગાલ્યાસજનિત જાતઅનુભવ લળે છે. ચિત્તમાં વિચાર-વમળોનો પૂર્વે વહેતો ઘોધ અહીં શાંત થતો જાય છે. અશુભ સંકદ્વિકદ્વય ઓછા રહે છે, અને કર્મકૃત વ્યક્તિત્વ સાથે પોતાની એકતાદ્વય ‘અહુ’ ઓગળતો જાય છે. ચિત્તમાંથી વિચારનો પ્રવાહ એસરતાં અહીં શાંતિનો-સુખનો-આનંદનો અનુભવ થાય છે.

સંકદ્વય-વિકદ્વયની અવપત્તા અને ‘અહુ’નું બહુધા અનુત્થાન-આ એમાં વિકાસ થતાં સ્વાનુભવ માટેની ભૂમિકા તૈયાર થાય છે. પરિણામે, ચોથી ભૂમિકામાં સ્વાનુભૂતિની કંઈક અંખી (glimpses) મળવા માંડે છે. પછી, કંઈક ધન્ય પળે, આત્માનું પ્રત્યક્ષ દર્શન લાધે છે, કે જે જીવન પ્રત્યેની સાધકની દિલમાં ધરમળતું પરિવર્તન લાવી હો છે; અવળી દિલ્લી સવળી થઈ જાય છે.

પ્રારંભમાં ક્ષણવાર અને કવચિતું કદાચિતું પ્રાપ્ત થતો આ અનુભવ પછીની સાધના દ્વારા વધુ સુલભ (frequent) અને વધુ ટકાવ થવો અને અંતે સમાધિની એ અવસ્થા-તુર્યાવસ્થા સહજ દર્શા બનવી એ છે અનુભવ પછીની જ્ઞાનની ભૂમિકાએ।

૪૧. (૧) આગમેનાડનુમાનેન, યોગભ્યાસરસેન ચ । ત્રિધા પ્રકલ્પયન્ત્રજ્ઞાં, લભતે તત્ત્વસુત્તમસ્ ॥  
—ચોગદિષ્ટસમુચ્ચય, શ્લોક ૧૦૧.

(૨) આગમ ને અનુમાનથી, વળી ધ્યાનરસેં ગુણુગેણ રે;  
કરે જે તત્ત્વગવેષણા, તે પામે નહિં સંદેશ રે.

—શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૭, ગાથા ૧૩.

૪૨. નિશ્ચયોડતીનિર્યાર્થસ્ય, યોગિજ્ઞાનાદતે ન ચ । —ચોગદિષ્ટસમુચ્ચય, શ્લોક ૧૪૧.

### આપણી સાધનાતું લક્ષ્ય

આમ કેમશા: સાધના કરતાં કરતાં આત્મતત્ત્વનાં અપરોક્ષ દર્શન—સમાપત્તિ<sup>૪૩</sup> સુધી પહોંચવું એ આપણી વર્તમાન ભૂમિકાનું લક્ષ્ય બનવું જોઈએ.

હા, એ માટે આપણા “અહુ”<sup>૪૪</sup>ને—આપણું કર્મકૃત વ્યક્તિત્વ, જેને મહિં પતંજલિ ‘અસ્ત્રિમતા’ કહે છે તેને—એગાળતાં રહેવું જોઈએ.

કર્મકૃત ભાવોમાં ‘હું’ બુદ્ધિ થવી એ મોહની જરૂર છે; એને અધીન જ મોહની આપી બાળ નલે છે.<sup>૪૫</sup>

કર્મકૃત ને અવસ્થાએ છે, તેમાં ‘હું’ બુદ્ધિ ન થવી એ જગૃતિ માગે છે. સ્વાતુભવ વિના નિત્યના જીવનબ્યવહારમાં આવી જગૃતિને ટકાવી રાખવી એ કપડું કાર્ય છે. કેવળ બૌદ્ધિક પ્રતીતિધી દેહાત્મભૂદ્ધિ ટળવી અસંભવપ્રાયઃ છે. એને માટે નિર્વિકલ્પ અવસ્થામાં આત્માતુભવ મેળવવો રહ્યો.

જેમ શિલ્પી પોતે ધારે તે ટાંકણું ઉપાડી શકે છે એને પોતાની ઈચ્છાતુસાર તેનો ઉપયોગ કરી પછી ઈચ્છે લારે તેને બાળુએ મૂકી શકે છે, તેમ સુસુક્ષુ પોતાના મનરૂપી સાધનનો પોતે ધારે ત્યારે એને તેટલો વખત ઉપયોગ કરી શકે એને ઈચ્છે લારે એને બાળુએ મૂકી શકે—એવી સ્થિતિ હોવી જોઈએ. એમાં જ્યારે એ પૂર્ણ સર્કળ થાય એને મનને તરંગ સ્થગિત—શાંત કરી હો—લાલે એવી સ્થિતિ ક્ષણભર જોટલી હોય—ત્યારે સ્વાતુભૂતિજન્ય આત્મજીનાન એને લાઘે.

### શુષ્ઠ જ્ઞાન

તે વિના, “હું આત્મા....શુષ્ઠ, બુદ્ધ, નિરંજન છું” એવી વાતો માત્ર પોપટપાડ છે.<sup>૪૬</sup> એની સ્થિતિ હોટલના વેઇટર (પિરસણિયા) જેવી છે. કોઈ અધતન દ્વારા હોટલમાં ચોજાયેલ પાર્ટીમાં, કઢક ઈસ્ક્રીપ્ટંધ, જીજળાં હૂધ જેવાં વાંચોમાં સંજર ‘વેઇટરો’ હૂધપાક પીરસી રહ્યા હોય કે મધુર સોડમાળી વિવિધ વાનગીઓની રકાખીએ (dishes) લઈને હોડાહોડ કરતા હોય તે જોઈ અધ્યુત્ત લિખારીને એમની સ્થિતિ સ્પૃહણીય—ઈચ્છવા ચોંચ—લાગે, પણ એમના અંતરમાં ડેકિયું કરી શકનાર, પાર્ટીમાં હૂધપાકનો આસવાદ માણુંતા,

૪૩. સમાપત્તિધ્યાનિતઃ સ્પર્શના ।

—યોગદિષ્ટભુવચ્ચય, રીકા, શ્લોક ૧૪.

૪૪. યે કર્મભૂતા ભાગાઃ પરમાર્થનયેન ચાસ્મનો મિકાઃ । તત્ત્રાયાઽયામિનિવેશોऽહઙ્કારોऽહં યથા નૃપતિ: ॥

મામાઽહઙ્કારનામાનો સેનાન્યૌ તૌ ચ તત્સુતૌ । યદાયત્: સુદુર્મેંદો મોહયુહુ: પ્રવર્તતે ॥

—તત્ત્વાતુશાસન, અધ્યાય ૧, શ્લોક ૧૫, ૧૩.

૪૫. (૧) જૌં લૌં મન થિર હોત નહીં છીન, જિમ પીપરકો પાન;

વેદ ભાગ્યો પણ શઠ (મૂર્ખ), પોથી થોથી જાણ રે.

ઘરમે પ્રગટ ભયો નહીં, જૌં લૌં અનુભવજ્ઞાન.

—ચિદાનંદ્જ મહારાજ.

(૨) અવયવ સહિ સુંદર હાયે હેઠે, નાડે હીસે ચાહો;

અથજીન અનુભવ વિષ્ણુ તેહવું, શુક કિસ્થે મુખપાડો રે.

—ઉપાધ્યાય પશોવિજયજી મહારાજ.

સહૃદયી મહેમાનોને તો તેમની (વેઈરોની) સ્થિતિ દ્વારામણી જ લાગે : બિચારો મણુથંધ ફૂધપાકની હેરફેર કરતો હોય પણ એને પોતાને તો એ ફૂધપાકનો સ્વાહ નસીબમાં જ નહિ ! જાનીની નજરે એવી જ કરુણ સ્થિતિ છે શુભકણાનીની.<sup>૪૬</sup>

શ્રુતના રસાસ્વાહ માટે અનુભવરૂપ જીલ જોઈએ;<sup>૪૭</sup> બુદ્ધિની કડછીથી એના રસનો આસ્વાહ ન મળે; એથી તો માત્ર શ્રુતની હેરફેર જ થાય.

### અનુભવ

શ્રુત એ જાનનો પડછાયો છે. પડછાયો કામ ન કરી શકે; કાર્ય કરનાર તો પડછાયાનું ઉદ્ભલવ સ્થાન—અનુભવ—જ છે.<sup>૪૮</sup> અનુભવનું વચન એ આગમ છે. શાસ્ત્રો અનુભવ-માંથી જન્મયાં છે, શાસ્ત્રવચનો પાછળ અનુભવનું બળ છે, તેથી તે શ્રદ્ધેય, આદેય અને અનુસરણીય બન્યાં છે. એકલાં વચન પકડીએ તેથી એનો આત્મા—શ્રુતનું રહસ્ય—ન પમાય. પડછાયાને પકડવાથી એનાં હુલનયલન ઉપર કાયુ નથી મેળવી શકાતો; પડછાયો જેનો છે તેને પકડો તો પડછાયો આપોઆપ્યે પકડાઈ જય છે.

નિજનાંહનો એક વાર—સાદે ક્ષણુભર પણ—અનુભવ મળવો જોઈએ. નિજનો નિરતિશય આનંદ મેળવ્યા પછી વિષયો (ઇન્દ્રિયોનાં લોગો) યથાર્થપણે નીરસ લાગે છે.<sup>૪૯</sup> અને સર્વ પુદ્ગલ-ખેલ ઇન્દ્રજાળ સમ સમજાય છે. આવા આત્મજાનીને મન જગતના ઘનાવોનું મહત્વ સ્વર્પનના ઘનાવોથી કંઈ અધિક રહેતું નથી.<sup>૫૦</sup>

બૌદ્ધિક પ્રતીતિ વિચારમાંથી જન્મે છે; પણ વિચાર પોતે જ અવિદ્યા ઉપર નિર્ભરાય.<sup>૫૧</sup>

૪૬. રસમાજનમે રહત દ્વય નિત, નહિ તસ રસ પાહિચાન;  
તિમ શ્રુતપાઠી પેંચિતકું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે.  
ઘટંચે પ્રગટ ભયો નહીં, જો લો અનુભવજ્ઞાન. —ચિદાનંદ મહારાજ.
૪૭. કેણ ન કલ્પનાદર્વી શાબ્દકીયાચાગાહિની । વિરલાસ્તદ્રસાસ્વાદવિદોઽનુભવજિહ્નયા ॥  
—શાનસાર, અનુભવાય્ય, શ્લોક ૫.
૪૮. દઢાજ્ઞાનમયી શઙ્કુમેનામપનિનીષઃ । અધ્યાત્મશાસ્ત્રમિચ્છન્તિ, શ્રોતું વેરાભ્યકાણ્ણિકઃ ॥  
દિશઃ પ્રદર્શકે શાખા—ચન્દ્રન્યાયેન તત્પુનઃ । પ્રલ્યક્ષવિષયાં શર્દીં, ન હિ હન્તિ પરોક્ષધીઃ ॥  
શ્રુત્વા મન્વા મુહુઃ સ્પૃત્વા, સાક્ષ દનુમ ભન્તિ યે । તત્વે ન બન્ધધીસ્તેષ—માત્માઽબન્ધઃ પ્રકાશતે ॥  
—અધ્યાત્મસાર, પ્રસ્તાવ ૬, શ્લોક ૭૪, ૧૭૫, ૧૭૭.
૪૯. (૧) અધ્યાર્દર્શન તસ્માચ્છુતદીપ જ તાત્ત્વિકમ् । —યોગદાનિસ્તુચ્યય, શ્લોક ૧૬.  
(૨) ન ચ અદૃષ્ટાત્મતસ્વસ્ય, દૃષ્ટભ્રાતર્નિર્વત્તતે । —અધ્યાત્મોપનિષદ્ધ, શાનયેણ૦, શ્લોક ૪
૫૦. (૧) આત્મજાને અગન જે, સેં સમ પુદ્ગલ ખેલ;  
ઇન્દ્રજાળ કરી લેખવે, ભીલે ન તિર્હ ભનમેલ. —સમાધિશતક.  
(૨) આત્મજાને મુનિર્મણઃ, સર્વ પુદ્ગલવિભ્રમમ् । મહેન્દ્રજાલવદ્વેતિ, નૈવ તત્ત્વાનુરૂપ્યતે ॥  
—અધ્યાત્મોપનિષદ્ધ, શાનયેણ૦, શ્લોક ૬.

૫૧. વિકલ્પકલ્પનાશિલ્પ, પ્રાયોડવિદ્યાવિનિર્મિતમ् ।  
ટીકા—“વિકલ્પા:” શાબ્દવિકલ્પા અર્થ વિકલ્પાશ, તેણા કલ્પનારૂપ શિલ્પ, ‘પ્રાયો’ બાહુલ્યેન,  
'અવિદ્યાવિનિર્મિત' જ્ઞાતાવરણીયાદિકર્મસંપર્કજનિતમ્ । —દ્વાત્રિંશદ્વાત્રિંશિકા, ૨૩, શ્લોક ૬.

છે; એટલે વિચાર શાંત થાય ત્યારે જ અનુભવ મળે. ૫૨ મનની ઉપશાંત અવસ્થા કે તેને નાશ એ ઉન્મની અવસ્થા છે. અને ઉન્મની અવસ્થામાં અનુભવ મળે છે. માટે આત્મ-જ્ઞાનની—અનુભવની પ્રાપ્તિ છચ્છતા મુખુક્ષુએ પ્રથમ ચંચળ ચિત્તને પોતાની છચ્છાતુસાર પ્રવર્તિવાતું સામર્થ્ય મેળવું રહ્યું; પછી એકાથ બનેલ એ ચિત્તને આત્મવિચારમાં જોડી એનો નાશ ડરવો। જેઈએ. ૫૩ મોહનનાશનો આ અમોદ ઉપાય છે. ૫૪

શું વર્ત્તમાન કાળે આત્માતુભવ મેળવી શકાય?

અને સ્વાતુભૂતિ આ જીવનમાં ન જ મળે એવું નથી; આપણા નિકટના કાળમાં થઈ ગયેલ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય શ્રી માનવિજયજી વાચક, મહાચૈગી આનંદઘનજી અને ચિહ્નાનંદજી મહારાજે પોતાને અનુભવ પ્રાપ્ત થયાના સ્પષ્ટ ઉદ્દેશે। કર્યા છે:—

- (૧) “માહરે તો ગુરુચરણ પસારે, અનુભવ દ્વિક્ષમાં પેડો;  
ત્રદ્વિ વૃદ્ધ પ્રગરી ધર્માંધી, આત્મ રતિ હુદ્ધ બેડો રે..” ૫૫  
—ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, શ્રીપાળરાસ, અંડ ૪, દાળ ૧૩.
- (૨) “અભિજિત જિનેસર ચરણની સેવા હેવાએ હું હળાએ;  
કઢીએ અણુચાંધ્યો પણું અનુભવ-રસનો ટાણો મીલીએ.  
...      ...      ...      ...

૫૨. (૧) કલ્પનાશિલપવિશ્રાંતેસ્તુયૈવાતુભૂતો દશા । —અધ્યાત્મોપનિષદ્ધ, જ્ઞાનચોગ્રં, શ્લોક ૨૪.  
(૨) નષ્ટે મનસિ સમન્નાત, સકલે વિલય ચ સર્વતો યાતે ।  
નિષ્કલ્પમુદેતિ તત્ત્વં, નિર્વાતસ્થયિ દીપ ઇવ ॥

ટીકા—નષ્ટે ભસમછાંમિવાંસમન્તસ્તિરોહિતે મનસિ । તથા સહ કલાભિશ્ચ તાસ્મલ્યાદિરૂપગમ્ભીર્તે યત્તસકલં તસ્મિન્ જલપ્રવાહાષ્ટાવિતવદ્વનિવદ્વિલય ક્ષયમુપગતે સતિ તત્ત્વમાત્મજ્ઞાનરૂપ નિષ્કલ્પ કર્મકલાવિનિર્મુક્તમુદેતિ । —યોગશાસ્ત્ર સઠીક, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૩૬.

૫૩. “વિશ્વિતાચેતસ: સ્વાભાવિકાદ્યાત્યાતે ચિત્તમભ્યસ્યેત, તતોડપિ વિશ્લિષ્ટ, તતોડપિ ચ સુલીન, એવं પુનઃપુનરભ્યાસાચ્ચિરાલભ્યં જ્ઞાનં ભવેત् । તતઃ સમરસમાવપ્રાતે: પરમાનન્દમનુભવતિ ।”  
—યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૫, ટીકા.

( ચિત્તની વિક્ષિપ્તાદિ અવરસ્થાઓનું વર્ણન શ્લોક ૩-૫ માં કર્યું છે. )

૫૪. (૧) આલંબ્યૈકપદાર્થ, યદા ન કિશ્ચદિવિન્યાદેન્યત્ ।  
અનુપનતેન્ધનવહૂનિવદુપશાન્તં સ્થાત્તદા ચેત: ॥  
શાન્તે મનસિ જ્યોતિઃ પ્રકાશતે શાન્તમાત્મનઃ સહજમ् ।  
મસ્તોભવલવિદ્યા, મોહષ્વાન્તં વિલયમેતિ ॥

—અધ્યાત્મસાર, અનુભવાધિકાર, શ્લોક ૧૭, ૧૮.

- (૨) કદલીવચ્ચાવિદ્યા લોલેન્દ્રિયપત્રકા( લા ) મનઃકંદા ।  
અમનસ્કફલે હષ્ટે નશયતિ સર્વપ્રકારેણ ॥ —યોગશાસ્ત્ર, પ્ર. ૧૨ શ્લોક ૪૦.

૫૫. (૧) “જિનયુષુ ચંદ કિરનસુ: ઉમગ્યો, કલાં સહજ સમુદ્ર અથાગ;  
દ્યાતા દ્યેય ભયે હાઉ એકઙુ, મીઠ્યો બેદ ડો ભાગ.”  
—ઉપાધ્યાય યશોવિજયજી : અન્દપ્રલભજિનસ્તવન.

પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પાખ્યો;  
આનવિજ્ય વાયક ઈમ જ'પે, કુંઝ મન કાખ્યો."

— અનિતાનાથઅનિતસતવન (ઉપાધ્યાય શ્રી આનવિજ્યળૃત ચોવીસી )

(૩) “ અવધુ અનુભવ કલિકા જગી,  
અતિ મેરી આતમ સમરન લાગી...  
અનુભવરસમે રોગ ન શોગા, દોષવાદ સથ મેટા;  
કેવળ અચળ અનાહિ શિવશંકર લેટા. અવધુ ૩  
વર્ષાભૂંદ સમુద્ર સમાની, ખખર ન પાવે ઢાઈ.  
આનંદધન હે જ્યોતિસલાવે, અલઘ કહાવે સોઈ. અવધુ ૪

—આનંદધનજી ગાહારાજ.

(૪) અનુભવ જ્યોતિ જગી છે હેણે અમારે એ,  
અનુભવ જ્યોતિ જગી છે. —ચિદાનંદ ઘેઠેતેરી, ૫૬ ૫૫.

આજે પણ એવી વિરલ વ્યક્તિઓ નહિ હોય એમ નહિ, એમને પારખવાની દિદિ જોઈએ. જે એમણે મેળાંયું તે આપણે પણ મેળવી શકીએ છીએ; જરૂર છે એ માટેના ચોંચ ડિશાના પુરુષાર્થની.

### સાધન અને પ્રેરણા

અથમ તો નિધાન આપણી પાસે જ પડયું છે, એનું લાન થવું જોઈએ. અને પછી એના સાધનનું જ્ઞાન મેળવી એની સાધનામાં લાગી જવું જોઈએ. સાધન છે સ્થિરતા. ૫૬ સ્વાનુભવ માટે ગ્રગાઢ શર્ણતિમાં સ્થિત થવું જોઈએ. પાત્રની સ્થિરતા વિના તેની અંદરની વસ્તુ સ્થિર ન થઈ શકે, માટે આત્મક્રદ્વયની સ્થિરતા આવે તે પહેલાં શરીર અને મન સ્થિર થયેલાં હોવાં જરૂરી છે. તેથી મનોરાધનો અલયાસ આવશ્યક થઈ પડે છે.

સ્વાનુભૂતિ અને સમયક્રત્વ સંકળાયેલાં છે. ૫૭

(૨) શુરુપ્રસાદ આતિમરતિ પાઈ, તામે મન ભયો લીન;  
ચિદાનંદધન અથ હુઈ એડે, કાહુકે નહિ આધિન. ૧  
ઘટ ગ્રગઠી સવિ સંપદા હો.

ઇન્દ્રાણી સમતા પવિ ધીરજ, જસ ઘટ જ્ઞાન વિમાન;  
જથ્ય સમાધિ-નંદનવનમેં ઘેલે, તથ હમ ધન્દ સમાન. ૨  
ચિંતામણી સુરતરુ સુરવેતુ, ડામકલશ ભયો પાસ;  
અષ્ટ મહાસિદ્ધિ, નવ નિધિ નિરખે, આપ મેં આપ વિલાસ. ૧૨  
વાયક જસવિજ્યે ઈમ દાખી, આતમ સાધિ રૂદ્ધિ;  
ભાખી સહયુરુ અનુભવ ચાખી, રાખીએ કરી ધનવૃદ્ધિ. ૧૫

૫૬. વત્તસ ! કિ ચચ્ચલસ્વાન્તો ભ્રાન્તવા આન્તવા વિષીદસિ ।

નિર્ધિ સ્વસંનિધાવેવ સ્થિરતા દર્શયિષ્યતિ ॥ —શાનસાર, સ્થિરતાઅષ્ટક, શ્લોઘ ૧.

૫૭. (૧) સમકિત દાર ગળારે પેસતાં જી,

લુંગળ કાંગી આધે ક્ષાયની જી, મિથાત્વમોહની સાંકળ સાથ રે;  
બાર જધાડું શમ-સંવેગનાં જી, અનુભવ ભવને પેડો નાથ રે.

જ્ઞાન સહિત કિયા એટલે જે કિયામાં શુત ઉપરાંત પોતાની-આત્માની સ્વાતુભૂતિન્ય પ્રતીતિ ભળી હોય તે, પણ એવો જ્ઞાની શ્વાસોશ્વાસમાં એટલી કર્મનિર્જરા કરી શકે જે અજ્ઞાની પૂર્વકોડ વર્ષ સુધીમાં પણ માંડ કરે. આવી વિપુલ કર્મનિર્જરા કરાવી આપનાર એવું જ્ઞાન મેળવવા પ્રત્યે ઉદાસીન રહેણાર સુસુક્ષુને સર્વેગ તીવ્ર ગણ્ય ખરે ?

જે જ્ઞાન વિના વિપુલ શુતજ્ઞાન પણ “જૂહુ” જ રહે છે, એ અનુભવજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રત્યેક સુસુક્ષુને કેવું આકર્ષણ્ય હોય ! અને તેમાંથે આત્મસાધના કાને જ જેણે લેખ લીધો તેને તો એની પ્રાપ્તિ માટે કેવી તાલાવેલી હોય ! તે શું માત્ર શાબ્દજ્ઞાનથી સર્તોષ માની નિરાંત અનુભવી શકે ખરે ?<sup>૧૫૮</sup>

ભાવી ગણ્યધરના આત્માના<sup>૧૫૯</sup> ધર્મશુરુ થવાનું સૌભાગ્ય જેમને સાંપડયું છે, તે “કલિકાલસર્વજ્ઞ” આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિલુ મહારાજે વિવેકશીલ સુસુક્ષુને સ્વાતુભવ-પૂર્ણ જે સલાહ આપી છે, અને ભાવી ગણ્યધર થનાર આત્માએ જેનું અન્યન્ય લાવે અનુસરણ કર્યું છે, તે આપણે અહીં જોઈશું<sup>૧૬૦</sup> આ રહી તે સલાહ :

“જે કંઈ હુઃખ છે તે આત્મજ્ઞાન રહિતને છે. આત્માનાં અજ્ઞાનજનિત તે હુઃખ અજ્ઞાનના પ્રતિપક્ષી આત્મજ્ઞાનથી શરૂ મેળે છે, નાશ પામે છે; જેમ પ્રકાશથી અંધકાર.”

“કર્મનો ક્ષય તો તપથી થાય, તો પછી આત્મજ્ઞાનને આટલું મહત્વ શા માટે ?” —એ શાંકાનું નિરસન કરતાં તેઓ કહે છે કે “ધીનાં અનુષ્ઠાનોની વાત તો હૂર રહી, જેને તમે નિર્જરાનું સુષ્ય કારણ કહેણ છો. તે તપથી પણ, આત્માના અજ્ઞાનમાંથી જન્મેલ

(૨) પોતાને અનુભવ લાધ્યાના ઉદ્ગારની સાથે ઉપાધ્યાય શ્રી યશોવિજયાલ મહારાજ કહે છે :

જીયો ભાગ્નિત રવિ અદ્ભુતો, ભરમતિભિર સવિ નાડો.

... ... ... ... ...  
હુંયો અનુભવ જેર હુતો જે મોહમલ્લ જગબુંડો,  
પરિપરિ તેહના મર્મ દેખાવી, બારે કૃધો જોડો રે.  
અનુભવગુણ આવ્યો નિજ અંગે, ભિટ્યો ઇપ નિજ માડો.

—શ્રીપાળરાસ, ખંડ ૪, દાળ ૧૩.

૪૬.

આત્મ દરિસથું જેણું કર્યું, તેણું ભૂંબો (ઢાકચો) ભવભયરૂપ રે.

ક્ષય અધેં જે અધ ઠંદે, તે ન ઠંદે ભવની હોડી રે,  
તપસ્યા કરતાં અતિ ધથ્યી, નહિ જ્ઞાન તથ્યી છે જોડી રે.

—શ્રીપાળરાસ, ખંડ ૪, દાળ ૭, ઉપ્ય-૩૮.

૪૭.

અધિગ્યાખિલં શબ્દબદ્ધ શાબ્દદ્વશા સુનિઃ ।

સ્વસંવેદં પરં બદ્ધાનુભવેનાડધિગચ્છતિ ॥

—રૂણસાર, અનુભવાષ્પક, ખ્લોક ૮.

૪૮.

કુમારપાણ મહારાજના.

“ યા શાબ્દાસુગુરોમુખાદનુભવાચાજાયિ કિશ્ચિતું કાચિતું, યોગસ્યોપનિષદ્ધિવૈકિપરિષ્વેતશમાકારિણી ।

શ્રીચૌલુક્યકુમારપાલનૃપતેરત્યર્થમભ્યર્થના-દાચાર્યેણ નિવેશિતા પથ ગિરાં શ્રીહેમચન્દ્રેણ સા ॥

દીક્ષા—અનુભવાચ = સ્વસંવેદનરૂપતા ।

—યોગશાખ, પ્રસ્તાવ ૧૨, ખ્લોક ૫૫.

હઃખ આત્મવિજ્ઞાનવિનાનાચોથી છેદી શકતું નથી; કારણું કે જ્ઞાન વિનાના તપણું ઇણ નહિયત છે.”

“ માટે, બીજી અંધી આગામી પાળ મૂકી દઈને રતનગ્રથના પ્રાણુભૂત આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો જોઈએ. અને....સ્વાતુભૂતિનું જ નામ આત્મજ્ઞાન છે; આત્મજ્ઞાન એ એનાથી જુદી કોઈ ચીજ નથી.”<sup>૧૨</sup>

“ અને....તે ( અનુભવ ) અસંભવિત છે એવુંથે નથી. જાતની શ્રીતિં કે યશોગાથાની ઐવના જેવી પોતાની કુરુ કામનાચોની તૃપ્તિ માટે જેટલી મહેનત માણુસ કરે છે, તેના કરતાં આ પ્રયાસ વધારે મુશ્કેલીથેરી નથી. આમાં તો પોતાના મન જેડે જ ચુદ્ધ કરવાનું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના “ એં જિગેજ અપ્પાં, એસ મે પરમો જબો । ”<sup>૧૩</sup> એ સૂત્રને પોતાનો જીવનમંત્ર ખનાવી દઈ, સર્વત્ર વીખરાયેલી પોતાની ચિત્તવૃત્તિએના નિરોધ કરી, ચિત્તને એકાથ કરવાનો અભ્યાસ રાખવાનો છે,”<sup>૧૪</sup> જેથી ઈચ્છાતુસાર તેને સ્વરૂપમાં જેડી શકાય અને, ત્યાં એનો લય કરવા દ્વારા, આત્માનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા લાધે.

“ પ્રારંભમાં એ કામ નીરસ અને નિષ્ઠળ લાગે છે, પણ સંકલ્પથળનો આધાર કાઢીને, અનેક વારની નિષ્ઠળતાઓને અવગણીને, અંત અને વણુથંલ્યા અથાડ પ્રયત્નથી તેને જ કાણુંમાં લેવાનું છે. આ કાર્ય જે પાર ઉત્તારે છે તેનું જીવન પ્રસન્નતાથી સભર અની રહે છે; માનવજીવનનું ખડું ઇણ મેળવી તે કૃતાર્થ અની જાય છે.

“ આ માર્ગે જનાર માટે એક ઉત્સાહપ્રેરક હુકીકત એ છે કે આ કાર્યમાં સાધકને સહા પોતાની હુદ્ધયજુદ્ધામાં બિરાજમાન “ પરમગુરુ ” તરફથી ચુંચ રીતે પ્રેરણા, માર્ગ-હર્ષન અને સહાય મળતાં જ રહે છે. આ એક નક્કર હુકીકત ( a fact ) છે એવો અનુભવ આ માર્ગ થોડાંક જ પગદાં મૂકનારને થયા વિના નથી રહેતો. પછી તો તેનું કામ એટલું જ રહે છે કે એ અવાજ સાંસારિક સહા સહાગ રહી પૂરી શ્રદ્ધાથી એનું અનુ-કારણ કરશું.”<sup>૧૫</sup>

#### અભિધારા

વિ. સં. ૨૦૨૩; પે ૪ શુક્રવાર ૧૨,

તા. ૨૩ ૨-૬૭

૧૨. “ આત્મજ્ઞાનમંત્ર દુઃखનાનજ્ઞનેન હન્ત્રયતે । તરસાડપ્યાત્મવિજ્ઞાનહીનૈછેતું ન શક્યતે ॥

ટીકા—એ સર્વ દુઃખમનાનજ્ઞનેન ભવતિ, તદાત્મજ્ઞાનમંત્ર ગ્રતિપક્ષભૂતેનાત્મજ્ઞાનેન શાન્યતિ ક્ષયમુપયાતિ, તમ ઇવ પ્રકાશેન । નનુ કર્મક્ષયહેતુઃ પ્રગાંત તર ઉકું ... ... હૃદ્યાહ, તપસાડપિ આસ્તામન્યેનનું ઠનેન તદાત્મજ્ઞાનમંત્ર દુઃખમનાનજ્ઞનહીનૈનૈન્દ્ધેતું શક્યતે, જ્ઞાનમન્તરેણ તપસોડલપફલત્વાત् । .... તત્ સ્થિતમેતત્ — બાદ્યવૈષયવ્યમોહમપહાય રત્નબ્રયસર્વેસ્વભૂતે આત્મજ્ઞાને પ્રયત્નિતદ્યમ્ । ... ... આત્મજ્ઞાનં ચ ... આત્મનઃ ચિદ્બૂપસ્ય સ્વરૂપેદનમેવ મૃગ્યતે, નાતોડન્યાતનજ્ઞનં નામ । ” —સાઠીક યોગશાસ્ત્ર, અકાશ ૪, શ્લોક ૩.

૧૩. ‘પોતાની જત ઉપર જ્ય મેળવ, એ તારે પરમ વિજ્ઞય બની રહેશે. બીજા બંધા વિજ્ઞયો એની આગળ હિંકા લાગશે.’

૧૪-૧૫ ‘અનાભી’ ઉપનામથી લેખક લખેલ એક લેખ “ પાયાનું કામ ” ( ‘ધર્મચક્ર’, જૂન ૧૯૬૨ )માંથી.